



### COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં જુલાઈ 27 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો, અને સીનિયર આઈડી કાર્ડ્સ માટે નવી ઓનલાઈન અરજી પ્રક્રિયા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 21, 2020) – સીટીના રિઓર્ગનીઝેશન અને રિકવરી પ્લાનના ભાગરૂપે, સોમવાર, જુલાઈ 27 થી, બસ સર્વિસમાં આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી નીચે મુજબના ફેરફારો થશે.

#### સર્વિસમાં ફેરફારો

આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ લોકોને શહેરની આસપાસ કાર્યક્ષમ રીતે હેરફેર કરાવી શકતી હોવાની ખાતરી કરાવવા, જુલાઈ 27 થી નીચેના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રૂટ્સ સંચાલનમાં રહેશે.

- 501 ઝુમ ક્વીન
- 502 ઝુમ મેઈન
- 511/511A ઝુમ સ્ટીવસ
- 1/1A ક્વીન
- 2 મેઈન
- 3 મેકલાઈલ
- 4/4A ટ્રિંગલુસી
- 5/5A બોવાર્ડ
- 6 જોન્સ પોર્ટર
- 7/7A કેનેડી
- 8 સેન્ટર
- 9 વોડેન
- 10 સાઉથ ઈન્ડસ્ટ્રીયલ
- 11/11A સ્ટીવસ
- 14/14A ટોરબ્રામ
- 15 બ્રેમલી
- 18 ડિક્સી
- 20A ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ
- 23 સેન્ડલવૂડ
- 26 માઉન્ટ પ્લેઝન્ટ
- 29 વિલિયમ્સ પાર્કવે
- 30 એરપોર્ટ રોડ
- 31 મેકવીન
- 35 ક્લાર્કવે
- 50 ગોર રોડ
- 51 હીયરફોર્ડ
- 52 મેકમર્થી
- 53 રે લોસન



- 56 કિંગનોલ
- 57 ચારોવેઈસ
- 60 મિસિસાગા
- 115 પીયરસન એરપોર્ટ એક્સપ્રેસ

હાલમાં સર્વિસ ચાલુ હોય તેવા રૂટ્સ અને તેના સમયપત્રકોની યાદી માટે વેબસાઈટ જુઓ, [www.bramptontransit.com](http://www.bramptontransit.com).

એક રિમાઈન્ડર તરીકે, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉન ટર્મિનલ્સના ટર્મિનલ બિલ્ડિંગમાં કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બંધ રહે છે. ટર્મિનલ્સમાં ગ્રાહક સેવાના ક્લાકો માટે વેબસાઈટ જુઓ, [www.bramptontransit.com](http://www.bramptontransit.com).

### સીનિયર આઈડી કાર્ડ્સ માટે નવી ઓનલાઈન અરજી પ્રક્રિયા

વડીલો હવે પોતાના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સીનિયર આઈડી કાર્ડ્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજદારોએ ઓનલાઈન ફોર્મ વેબસાઈટ [www.bramptontransit.com](http://www.bramptontransit.com) પર ભરવું, અને પોતાના કાર્ડ્સ પર ઉપયોગમાં લેવા પોતાનો ઉંમરનો પુરાવો, બ્રેમ્પટન રેસિડન્સી અને ફોટાનું બિડાણ કરવું અનિવાર્ય બને છે. આ કાર્ડ અરજદારને ત્યાર પછી ટપાલથી મોકલવામાં આવશે.

તમામ સક્રિય સીનિયર આઈડી કાર્ડ્સની સમાપ્તિની તારીખો અનિશ્ચિત સમય સુધી માફ કરવામાં આવી છે. વડીલો આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી પોતાનું એક્સ્પાયર્ડ કાર્ડ વાપરવાનું ચાલુ રાખી શકે છે.

જો વડીલોનું પોતાનું બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સીનિયર આઈડી કાર્ડ ખોવાઈ ગયું હોય અને રિપ્લેસમેન્ટ કાર્ડ જોઈતું હોય તો, તેઓ પોતાના કાર્ડ્સ તબદીલ કરવાની રીત જાણવા વધુ સૂચનો માટે સીનિયર કાર્ડ પ્રોગ્રામનો સંપર્ક 905-874-2750 એક્સ્ટેન્શન નંબર 16253 પર કરી શકે છે.

### COVID-19 સેફ્ટી મેઝર્સ (સુરક્ષા ઉપાયો)

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી માર્ક પહેર્યો હોય તો પણ ઉતારુઓને ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને મુસાફરી કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ મારક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ [www.brampton.ca/covid19](http://www.brampton.ca/covid19) અને [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.



# BRAMPTON

## Service and Information Update

**मिडिया संपर्क :**

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडान्मक संवाड

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)